

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૯/૦૭/૨૦૧૭ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૪૬૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી ૩૫ વ્યક્તિઓને ઝડપી, ૪૬૨ લીટર દેશી દારૂ, ૯૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૭૯ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૩૨૬ બિયર ટીન અને ૨ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૦,૦૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૬૯/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૪૭૦/૧૭

સરખેજ: રેવાભાઈ મલાભાઈ મકવાણા (રહે. હરીવીલા સોસાયટી બાપા સીતારામ મઢુલી પાછળ ઘોળકા રોડ આનંદ આશ્રમ પાછળ નવી ફતેવાડી સરખેજ) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. કે તા.૧૭/૭/૧૭ કલાક ૧૧/૦૦ થી તા.૧૮/૭/૧૭ કલાક ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ કિંમત રૂપિયા ૪૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.બી.ચૌધરી ચલાવે છે.

સોલા હાઈકોર્ટ: વિરલકુમાર જીતેન્દ્રકુમાર પટેલ (રહે. શાયોના તીર્થ આઇ.ડી.પટેલ સ્કુલ પાસે સોલા) એ તા.૧૮/૭/૧૭ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. કે તા.૨૮/૬/૧૭ કલાક ૮/૦૦ થી તા.૧૫/૭/૧૭ કલાક ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું હેન્ડલ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના કિંમત રૂપિયા ૧,૩૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.રાજપુત ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૪૭૧/૧૭

સરદારનગર: જીયાબહેન વા/ઓ નરેન્દ્ર ચોઈથા (ઉ.વ.૩૩) (રહે. ભાગ્યોદય સોસાયટી સરગમ ફ્લેટની સામે અંજલી સ્ટોરની ગલીમાં બંગલા એરીયા કુબેરનગર તા.૧૮/૭/૧૭ સવારના ૭/૦૦ વાગ્યાના સુમારે સરગમ ફ્લેટ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૦ થી ૨૫ વર્ષના આશરાના) બે પુરૂષ જીયાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ જીયાબહેન ચોઈથાએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.જે.ખરસાણા ચલાવે છે.

શહેરકોટડા: જયોત્સનાબહેન વા/ઓફ મહેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૫૦) (રહે. મન્સુરીની ચાલી ઇટવાડા સર્કલ સરસપુર) તા.૭/૭/૧૭ રાતના ૮/૪૫ વાગ્યાના સુમારે સરસપુર બાલાપીર દરગાહ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ જયોત્સનાબહેન ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૨૭,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ જયોત્સનાબહેન પરમારે તા.૧૮/૭/૧૭ નારોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એ.બારોટ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૪૭૨/૧૭

બાપુનગર: કંચનબહેન વા/ઓ યોગેન્દ્રભાઈ જેઠવા (ઉ.વ.૬૭) (રહે. અલકાપુરી સોસાયટી નિકોલ ગામ રોડ) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. કે તા.૧૭/૭/૧૭ સાંજના ૫/૩૦ વાગ્યાના સુમારે બાપુનગર સુરધારા સોસાયટી થી એપ્રોચ હવેલી મંદિર સુધી શટલ ઓટોરિક્ષાની મુસાફરી દરમ્યાન રિક્ષા ચાલકની મદદગારીથી રિક્ષામાં બેઠેલ બે પુરૂષ અને એક સ્ત્રીએ કંચનબહેનની નજર ચુકવી કંચનબહેને પહેરેલ સોનાની બંગડીકિંમત રૂપિયા ૧૮,૦૦૦/- મતાની કાઢી લઈ ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી મથુ રભાઈ ફતાભાઈ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૪૭૩/૧૭

ઓઢવ: કાનજીભાઈ મહાદેવભાઈ દેસાઈ (રહે.ભવનીનગર ટેકરા ઉપર રબારી વસાહત પાસે સી.એમ.સી વેરો ઓઢવ) એ તા.૧૧/૭/૧૭ રાતના ૧૦/૩૦ વાગે રહેણાંક નજીક પોતાની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે ૨૭ એક્સ ૯૦૩૯ કિંમત રૂપિયા ૫,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧૨/૭/૧૭ સવારના ૭/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ કાનજીભાઈ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ડી.ભદ્ર ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૪૭૪/૧૭

રામોલ: કૈલાશબહેન વા/ઓ ભુપેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૩૬) (રહે. શિવપાર્ક સોસાયટી રામરાજયનગર વસ્ત્રાલ) એ અગમ્ય કારણસર તા.૧૮/૭/૧૭ સવારના ૮/૦૦ થી બપોરના ૩/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી પી.ડી.સોલંકી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.